



RAN-2401000105020561

B.A. (Sem. V) (Non NEP) Examination November - 2025
Economics (Paper - XI) Macro Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
 Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર.1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ) (10)**
- (1) એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું?
 - (2) નાણાંકીય આવકની ગણતરી કયા ભાવે કરવામાં આવે છે?
 - (3) રાષ્ટ્રીય આવકની ફિશરની વ્યાખ્યા લખો.
 - (4) જો શ્રમની સીમાંત ઉત્પાદકતા તેના વાસ્તવિક વેતન કરતાં વધુ હશે તો શ્રમની માંગ કેવી હશે?
 - (5) પૂર્ણ રોજગારી એટલે શું?
 - (6) ગરીબવર્ગની સીમાંત વપરાશવૃત્તિ શા માટે વધારે હોય છે?
 - (7) વપરાશ વિધેય દર્શાવો.
- પ્ર.2. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તેનું કાર્યક્ષેત્ર, મહત્વ અને મર્યાદા તપાસો. (13)**
- અથવા**
- પ્ર.2. (અ) રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ સમજાવો. (06)**
- (બ) રાષ્ટ્રીય આવકના અભ્યાસનું મહત્વ ચર્ચો. (07)**
- પ્ર.3. મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ખ્યાલ વિગતે સમજાવી તેને અસર કરતાં પરિબળો ચર્ચો. (13)**
- અથવા**
- પ્ર.3. (અ) પિગુનો વેતનકાપનો સિદ્ધાંત સમજાવો. (07)**
- (બ) વપરાશવૃત્તિને અસર કરતાં વસ્તુલક્ષી પરિબળો ચર્ચો. (06)**
- પ્ર.4. ટૂંકનોંધ લખો. (ગમે તે બે) (14)**
- (1) એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર.
 - (2) રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી.
 - (3) જે. બી. સેનો બજારનો નિયમ.
 - (4) મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ.

ENGLISH VERSION

- Q.1. Answer the following questions briefly. (Any five) (10)**
- (1) What is micro economics?
 - (2) At what price is monetary income calculated?
 - (3) Write Fisher's definition of national income.
 - (4) What will be the demand for labour if the marginal productivity of labour is greater than its real wages?
 - (5) What is full employment?
 - (6) Why the marginal propensity to consume of the poor is high?
 - (7) Indicate the consumption function.
- Q.2. What is macro economics? Examine its scope, importance and limitations. (13)**
- OR**
- (A) Explain the methods of calculating national income. (06)
 - (B) Discuss the importance of study of national income. (07)
- Q.3. Explain the concept of marginal efficiency of capital in detail; discuss the factors affecting to it. (13)**
- OR**
- Q.3. (A) Explain the wage cut theory of Pigou. (07)**
- (B) Discuss objective factors affecting propensity to consume. (06)**
- Q.4. Write short note. (Any two) (14)**
- (1) Scope of micro economics.
 - (2) Difficulties in calculating national income.
 - (3) J. B. Say's market theory.
 - (4) Marginal efficiency of capital and investment.
-